

કોર્ટ ઓફ કમિશનર (વિકલાંગ વ્યક્તિઓ માટેના)

ગુજરાત રાજ્ય

(Deemed Civil Court) વિકલાંગ ધારો (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ૧૯૯૫

ભોંયતળિયે બ્લોક નં. ૧૬, જુના સચિવાલય, સેક્ટર-૧૦, ગાંધીનગર- ૩૮૨૦૧૦

કેસ નં. ૫૪૫/૨૦૧૬

ક્રમાંક કમિ/અપગ/૨૦૧૬-૧૭ /

તા. /૦૭/૨૦૧૬

વાદી:-

શ્રી રાજેશભાઈ કાંતીભાઈ ઝવેરી,

સરનામું: " ગાયત્રી કૃપા" એફ /૨૯

ગુજરાત હાઉસીંગ બોર્ડ, સોસાયટી, એસ.ટી.ડેપો, પાછળ

અમરેલી, જિ. અમરેલી

વિરુદ્ધ

પ્રતિવાદી -

(૧) જનરલ મેનેજરશ્રી,

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન,

મેઇન ઓફિસ, નરોડા, અમદાવાદ

(૨) ડીવીઝનલ મેનેજરશ્રી,

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન,

ભાવનગર ડીવીઝન, ભાવનગર, જિ. ભાવનગર

(૩) ડેપો મેનેજરશ્રી,

ગુજરાત રાજ્ય, માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન,

અમરેલી, ડીવીઝન જિ. અમરેલી

૧. શ્રી રાજેશભાઈ કાંતીભાઈ ઝવેરી, " ગાયત્રી કૃપા" એફ /૨૯, ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી, એસ.ટી.ડેપો, પાછળ, અમરેલી, જિ. અમરેલી ધ્વારા તેઓની તા.૨૭/૬/૨૦૧૬ ની અરજીથી તેઓની તા.૪/૬/૨૦૧૬ ના રોજની સોનગઢ થી પાલીતાણા સુધીના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસમાં કંડકટરને વિકલાંગ પાસ બતાવવા છતાં તે માન્ય નહીં રાખી ટીકીટ આપી પ્રવેશ કરવા દીધેલ છે તે બાબતની રજુઆત કરેલ છે.

૨. શ્રી ઝવેરીની ઉપરોક્ત અરજીને કેસ નં. ૫૪૫/૨૦૧૬ તરીકે દાખલ કરી જનરલ મેનેજરશ્રી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન, અમદાવાદ અને ડીવીઝનલ

મેનેજરશ્રી, ભાવનગર તથા ડેપો મેનેજરશ્રી, અમરેલીને પ્રતિવાદી દર્શાવી તા.૧૨/ ૭/૨૦૧૬ ના રોજ મુદત રાખવામાં આવેલ.

૩. મુદતે અરજદારશ્રી રાજેશભાઈ કાંતીભાઈ ઝવેરી ઉપસ્થિત રહેલા નથી, પરંતુ તેઓની અન ઉપસ્થિતિમાં તેઓની તા.૨૭/૬/૨૦૧૬ ની અરજી ધ્યાનમાં લેવામાં આવેલ તે મુજબ શ્રી ઝવેરી તા.૪/૬/૨૦૧૬ ના રોજ ભાવનગરના સોનગઢથી પાલીતાણા જવા માટે ભાવનગર ડીવીઝનની બસ નં.જીજે-૧૮- ઝેડ ૧૦૬૮ માં મુસાફરી કરતા હતા. ત્યારે બસ કંડકટરને આઈડેન્ડીટી કાર્ડ બતાવી રાજ્ય સરકારના તા.૧૬/૫/૨૦૧૬ ના ઠરાવની જોગવાઈઓ દર્શાવી વિકલાંગ વ્યક્તિ તરીકે વગર ટીકીટ મુસાફરી કરવા દેવા રજુઆત કરેલ. પરંતુ સદરહુ બસના કંડકટર ધ્વારા તેઓની રજુઆત માન્ય રાખેલ નહીં અને ટીકીટ પૂરી પાડેલ. સદરહુ ટીકીટની પાછળ કંડકટર ધ્વારા નોંધ લખવામાં આવેલ કે, “ વિકલાંગ પાસ છે પરંતુ એક્સ્ટ્રા સંચાલક હોવાથી ટિકીટ આપેલ છે.” જેને ધ્યાને લઈ કંડકટર સામે નિયમાનુસાર કાર્યવાહી કરવા તેઓએ દાદ માંગેલ છે.

૪. કેસની સુનાવણીમાં તા.૧૨/૭/૨૦૧૬ ના રોજ ડેપો મેનેજરશ્રી, અમરેલીના પ્રતિનિધિ શ્રી વી.એચ.નથવાણી હાજર રહેલ. તેઓએ જણાવેલ કે, પ્રસ્તુત ફરિયાદ ભાવનગર ડીવીઝનની હોઇ સદરહુ અરજી બાબતે નિયમાનુસાર કાર્યવાહી કરવા તે અરજી તેઓએ ભાવનગર ડીવીઝનને મોકલી આપેલ છે.

૫. તા.૧૨/૭/૨૦૧૬ ની સુનાવણીમાં ડીવીઝનલ કચેરી, ભાવનગરના પ્રતિનિધિશ્રી જી.બી. ઇસરાણી હાજર રહેલા. તેઓએ તા.૧૧/૭/૨૦૧૬ ના લેખિત પત્ર સાથે જણાવેલ કે, અરજદાર શ્રી ઝવેરી તા.૪/૬/૨૦૧૬ ના રોજ ભાવનગર ડેપોની ગાડી નં. જીજે-૧૮ ઝેડ ૧૦૬૮ માં સોનગઢ થી પાલીતાણા મુસાફરી કરતા હતા ત્યારે સદરહુ બસના કંડકટર શ્રી દિલીપસીંહ યુડાસમા ધ્વારા અરજદારને ટીકીટ આપી. ભાડાના નાણાં વસુલ લેવામાં આવેલ. પ્રસ્તુત બાબતે જવાબદાર કંડકટર સામે ખાતાકીય તપાસની કાર્યવાહી કરવા વિભાગીય પરિવહન અધિક્ષક ધ્વારા ડેપો મેનેજર, ભાવનગરને સુચના આપવામાં આવેલ છે. પરંતુ ડેપો મેનેજર ભાવનગર ધ્વારા આજ દિન સુધી તે પરત્વે તેઓએ કરેલ કાર્યવાહીનો અહેવાલ મોકલી આપેલ નથી. આ બાબતે ભાવનગર ડેપો મેનેજર ધ્વારા ફરિયાદ પરત્વે બેદરકારી દાખવવા અને જવાબદાર કંડકટર સામે કાર્યવાહી નહીં કરવા બદલ તેઓ સામે કરેલ કાર્યવાહીની વિગતો હવે પછી રજુ કરશે.

૬. કેસની ઉક્ત વિગતે સમગ્ર બાબતો ધ્યાને લેતા આ કેસમાં નીચે મુજબની બાબતો જણાઈ આવે છે.

(૧) રાજ્ય સરકાર ધ્વારા તા.૧૬/૦૫/૨૦૧૬ ના ઠરાવથી તમામ પ્રકારની વિકલાંગતા ધરાવતા વિકલાંગ વ્યક્તિને (૪૦ ટકાથી વધારાને) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની લોકલ, એક્સપ્રેસ, ગુર્જર નગરી, ડિલક્ષ, વોલ્વો અને એ.સી.

સહિતની તમામ પ્રકારની બસમાં આઇડેન્ટીના કાર્ડના આધારે મફત મુસાફરી કરવા દેવા સુચના આપેલ છે. આમ છતાં ઘણા કન્ડક્ટરશ્રી ધ્વારા તેનો અમલ કરવામાં આવેલ નથી. અને વિકલાંગ અરજદારોને ટિકીટ પૂરી પાડી ભાડાના નાણા વસુલ કરે છે.

- (૨) એસ.ટી. બસમાં વિકલાંગ વ્યક્તિ માટે સીટ નંબર ૮ અને ૯ અનામત રાખેલ હોવા છતાં વિકલાંગ વ્યક્તિને તે સીટ ઉપર બેસવા દેવામાં આવતા નથી.
- (૩) ડેપો મેનેજર ભાવનગર ધ્વારા પ્રસ્તુત કેસમાં જવાબદાર કન્ડક્ટર સામે શિક્ષાત્મક કાર્યવાહી નહી કરી બેદરકારી દાખવેલ છે.

ઉપર દર્શાવેલ તમામ બાબતો ધ્યાને લઈ હું નીચે મુજબ હુકમ કરું છું.

હુકમ

પ્રસ્તુત કેસમાં વિકલાંગ અરજદારશ્રી રાજેશભાઈ કાંતીભાઈ ઝવેરીનું વિકલાંગતા ધરાવતા હોવાનું આઇડેન્ટીટી કાર્ડ માન્ય નહી રાખી ટિકીટ આપનાર જવાબદાર કન્ડક્ટર સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે તથા જવાબદાર કન્ડક્ટર સામે ખાતાકીય તપાસની કાર્યવાહી નહી કરી ફરજમાં બેદરકારી દાખવનાર ભાવનગર ડેપો મેનેજરશ્રી સામે નિયમાનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવે.

પ્રસ્તુત હુકમ સાથે હું આ કેસનો નિકાલ કરું છું.

(સંજય નંદન)

કમિશનર

નકલ રવાના:-

- (૧) શ્રી રાજેશભાઈ કાંતીભાઈ ઝવેરી, સરનામુ: " ગાયત્રી કૃપા" એફ /૨૯ગુજરાત હાઉસીંગ બોર્ડ, સોસાયટી, એસ.ટી. ડેપો પાછળ, અમરેલી, જિ. અમરેલી તરફ જાણ સારૂ.
- (૨) જનરલ મેનેજરશ્રી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન, મેઇન ઓફિસ, નરોડા, અમદાવાદ
- (૩) ડીવીઝનલ મેનેજરશ્રી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન, ભાવનગર ડીવીઝન, ભાવનગર, જિ. ભાવનગર
- (૪) ડેપો મેનેજરશ્રી, ગુજરાત રાજ્ય, માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન, અમરેલી, ડીવીઝન જિ. અમરેલી

